

**Ref. No.** DIL/SE/24-25/94

**Date:** March 26, 2025

To,

**The Manager**

**Corporate Relationship Department**

**BSE Limited**

Phiroze Jeejeebhoy Towers,

Dalal Street,

Mumbai - 400 001

**The Manager**

**Listing Department**

**National Stock Exchange of India Limited**

Exchange Plaza, Bandra Kurla Complex,

Bandra (East),

Mumbai - 400 051

**BSE Symbol - DOMS**

**BSE Scrip Code - 544045**

**NSE Symbol - DOMS**

**Subject: Intimation of Newspaper Advertisement of Postal Ballot Notice**

Dear Sir/ Madam,

Pursuant to Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended ('SEBI LODR Regulations') and with reference to our intimation letter dated March 25, 2025, vide Ref. No. DIL/SE/24-25/93 regarding the Postal Ballot Notice, please find enclosed the copies of the newspaper advertisement pertaining to the Postal Ballot Notice.

The advertisement were published on March 26, 2025, in Financial Express (English) and in Damanganga Times (Gujarati).

The Newspaper advertisement is also available on the website of the Company at [www.domsindia.com](http://www.domsindia.com).

The above is for your kind information and record.

Thanking you,

Yours faithfully,

**For DOMS Industries Limited**

**Mitesh Padia**

**Company Secretary and Compliance Officer**

**Membership No. A58693**

**Encl.: As Above**

**Registered Office:**

J-19, Opp. Telephone Exchange,  
G.I.D.C., Umbergaon- 396171,  
Dist. Valsad, Gujarat, India.

**Website:**

[www.domsindia.com](http://www.domsindia.com)

**Corporate Office:**

Plot No. 117, G.I.D.C., 52, Hector Expansion  
Area, Umbergaon- 396171,  
Dist. Valsad, Gujarat, India.

**Tel:** (+91) 7434888445 / 446

**E-mail:** [info@domsindia.com](mailto:info@domsindia.com)

**Mumbai Office:**

17th Floor, C-Wing, Kailas Business Park,  
Hiranandani Link Road, Vikhroli (W)  
Mumbai- 400079, Maharashtra, India.

**Tel:** (+91) 7069028500 / 600

**Email:** [asst.admin@domsindia.com](mailto:asst.admin@domsindia.com)



### YURANUS INFRASTRUCTURE LIMITED

CIN: L1410G1999GP0001352  
 Regd. Office: Ramnagar, First Floor, Sankalp Grace 3, Near Ishan Bunglows, Shilpi, Ahmedabad - 380056, Gujarat, Bharat. Tel: +91-96985 37186  
 Website: www.yuranusinfra.com; E-mail: id: cs@yuranusinfra.com

#### POSTAL BALLOT NOTICE

NOTICE is hereby given pursuant to the provisions of Sections 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("the Act") read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("the Rules"), Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standards on General Meetings (SSG-2) issued by the Institute of Company Secretaries of India, and in accordance with the requirements prescribed by the Ministry of Corporate Affairs ("the MCA") for conducting postal ballot process through e-voting, vide their circulars issued from time to time (collectively, "the MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/CFO-POD-2/P/2020/24313 dated October 3, 2020 issued by the Securities and Exchange Board of India ("SEBI") read together with previous circulars issued by SEBI in this regard ("SEBI Circulars") the approval of Members of Yuranus Infrastructure Limited ("the Company") is being sought for the below mentioned business (detailed business have been provided in the Notice of Postal Ballot dated February 11, 2025), by way of voting by electronic means (hereinafter termed as "Remote E-Voting") by following the process of Postal Ballot and remote e-voting.

Sr. No.	Description of Resolutions	Resolution Type
1.	To Approve Appointment of Ms. Shobha Bhatti (DIN: 05318463) as an Independent Director of the Company	Special

In compliance with the above circulars, electronic copies of the Notice of Postal Ballot along with explanatory statement have been sent through electronic mode only, to those Members whose names appeared in the Register of Members ("List of Beneficial Owners maintained by the Company") Depositories as on Friday, March 21, 2025 ("the Cut-off Date") and whose e-mail IDs are registered with the Company's Depositories. Member may note that the Notice of Postal Ballot along with explanatory statement and instruction of e-voting, have been uploaded on the website of the Company at www.yuranusinfra.com, website of BSE Limited at www.bseindia.com and website of National Securities Depository Limited (NSDL) at www.nsdl.co.in. The members whose names appeared in the Register of Members and the Register of Beneficial Owners as on the Cut-off date are entitled to vote on the Resolution as set forth in the Notice. A person who is not a member as on the Cut-off date shall treat the Notice for information purpose only. In accordance with the MCA Circulars, the Company has provided the facility to vote on the resolutions by e-voting and for this purpose, the Company has engaged the services of National Securities Depository Limited (hereinafter referred to as "NSDL" or "Service Provider") for facilitating e-voting to enable the Members to cast their votes. The detailed procedure and instructions for e-voting are enumerated in the Notice.

In light of the MCA Circulars, the shareholders holding equity shares in Demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the Notice of Postal Ballot along with explanatory statement and instruction of e-voting could not be sent electronically, may temporarily get their e-mail addresses registered by following the procedure given below:

- In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by E-mail to cs@yuranusinfra.com.
- In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID -CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to cs@yuranusinfra.com.
- Alternatively, shareholders may send a request to eoting@nsdl.co.in for procuring user id and password for e-voting by providing above mentioned documents.

The Company has engaged the services of National Securities Depository Limited (hereinafter referred to as "NSDL" or "Service Provider") for facilitating e-voting to enable the e-voting facility will be available during the following period:

Commencement of e-voting	End of e-voting
From 9:00 a.m. (IST) on Thursday, March 27, 2025	Until 5:00 p.m. (IST) on Friday, April 25, 2025

Once the vote is cast on the resolution, the Member will not be allowed to change it subsequently or cast the vote again.

The Board has appointed **M/s. Piroda Nayan & Co., Practicing Company Secretary (Membership No. 58473, CP No. 23912)** as a Scrutinizer ("Scrutinizer") for conducting the e-voting process in a fair and transparent manner.

The result of the postal ballot will be announced within 2 (two) working days from the conclusion of e-voting i.e. on or before **Thursday, April 29, 2025** and communicated to the stock exchanges and will be displayed on the Company's website i.e. www.yuranusinfra.com.

In case of any query and/or grievance in respect of voting by electronic means, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.eoting.nsdl.com or you can write an email to eoting@nsdl.co.in or Call us: Tel: 022-4866 7000 or Members may also contact Mr. Shyamsunder Panchal, Company Secretary of the Company at the registered office of the Company or may write an e-mail to investor@nsdl.co.in for further clarification.

Date: March 25, 2025  
 Place: Ahmedabad  
 For, Yuranus Infrastructure Limited  
 Nishinil Gajiwadhi Patel  
 Chairman Cum Managing Director  
 DIN: 06626646

**AXITA COTTON LIMITED**  
 CIN: L1700XG013PL070659  
 Registered Office: Survey No. 324, 387, 358, Borisana, Kad - Thol Road, Kad, Mahesana - 382715, Gujarat, Bharat  
 Corporate Office: Ramnagar House, First Floor, Opp. Sankalp Grace 3, Near Ishan Bunglows, Shilpi, Ahmedabad - 380056, Gujarat, Bharat  
 Telephone: +91-658774154  
 Email: cs@axitacotton.com, investor@axita.in  
 Website: www.axitacotton.com

NOTICE is hereby given pursuant to the provisions of Sections 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("the Act") read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("the Rules"), Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standards on General Meetings (SSG-2) issued by the Institute of Company Secretaries of India, and in accordance with the requirements prescribed by the Ministry of Corporate Affairs ("the MCA") for conducting postal ballot process through e-voting, vide their circulars issued from time to time (collectively, "the MCA Circulars"), the approval of Members of Axita Cotton Limited ("the Company") is being sought for the below mentioned business (detailed business have been provided in the Notice of Postal Ballot dated February 10, 2025), by way of voting by electronic means (hereinafter termed as "Remote E-Voting") by following the process of Postal Ballot and remote e-voting.

Sr. No.	Description of Resolutions	Resolution Type
1.	To Approve Appointment of Ms. Shobha Bhatti (DIN: 05318463) as an Independent Director of the Company: Special Resolution	Special

In accordance with the above circulars, the e-Notice of Postal Ballot along with explanatory statement have been sent through electronic mode only, to those Members whose names appeared in the Register of Members ("List of Beneficial Owners maintained by the Company") Depositories as on Friday, March 21, 2025 ("the Cut-off Date") and whose e-mail IDs are registered with the Company's Depositories. Member may note that the Notice of Postal Ballot along with explanatory statement and instruction of e-voting, have been uploaded on the website of the Company at www.axitacotton.com, website of BSE Limited at www.bseindia.com, National Stock Exchange Limited website at www.nseindia.com and website of National Securities Depository Limited (NSDL) at www.eoting.nsdl.com.

Further, pursuant to the MCA Circulars, the requirement of sending physical copy of the Notice, Postal Ballot forms and pre-paid business reply envelope has been dispensed with.

The members whose names appeared in the Register of Members and the Register of Beneficial Owners as on the Cut-off date are entitled to vote on the Resolution as set forth in the Notice. A person who is not a member as on the Cut-off date shall treat the Notice for information purpose only. In accordance with the MCA Circulars, the Company has provided the facility to vote on the resolutions by e-voting and for this purpose, the Company has engaged the services of National Securities Depository Limited (hereinafter referred to as "NSDL" or "Service Provider") for facilitating e-voting to enable the Members to cast their votes electronically instead of dispatching postal ballot forms. The detailed procedure and instructions for e-voting are enumerated in the Notice.

In light of the MCA Circulars, the shareholders holding equity shares in Demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the Notice of Postal Ballot along with explanatory statement and instruction of e-voting could not be serviced, may temporarily get their e-mail addresses registered by following the procedure given below:

- In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by E-mail to investor@axitacotton.com.
- In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID -CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to investor@axitacotton.com.
- Alternatively, shareholders may send a request to eoting@nsdl.co.in for procuring user id and password for e-voting by providing above mentioned documents.

The Company has engaged the services of National Securities Depository Limited (hereinafter referred to as "NSDL" or "Service Provider") for facilitating e-voting to enable the e-voting facility will be available during the following period:

Commencement of e-voting	End of e-voting
From 9:00 a.m. (IST) on Thursday, March 27, 2025	Until 5:00 p.m. (IST) on Friday, April 25, 2025

Once the vote is cast on the resolution, the Member will not be allowed to change it subsequently or cast the vote again.

The Board has appointed **M/s. Piroda Nayan & Co., Practicing Company Secretary (Membership No. 58473, CP No. 23912)** as a Scrutinizer ("Scrutinizer") for conducting the e-voting process in a fair and transparent manner.

The result of the postal ballot will be announced within 2 (two) working days from the conclusion of e-voting i.e. **Thursday, April 29, 2025** and communicated to the stock exchanges and will be displayed on the Company's website i.e. www.axitacotton.com.

In case of any query and/or grievance in respect of voting by electronic means, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.eoting.nsdl.com or you can write an email to eoting@nsdl.co.in or Call us: Tel: 022-4866 7000 or Members may also contact Mr. Shyamsunder Panchal, Company Secretary of the Company at the registered office of the Company or may write an e-mail to investor@nsdl.co.in for further clarification.

Date: March 25, 2025  
 Place: Kad, Mahesana  
 For, Axita Cotton Limited  
 Nishinil Gajiwadhi Patel  
 Chairman Cum Managing Director  
 DIN: 06626646

### NOTICE OF LOSS OF SHARES OF LARSEN & TOUBRO LIMITED

L&T House, Ballard Estate, Mumbai-400001

NOTICE is hereby given that the Certificate (s) for under mentioned below equity Shares No. 50 of the following:

Name of Company	Holder Name	Folio No.	Certificate No.	From Distinctive No.	To Distinctive No.	Rs. 2/- HOLDING
-----------------	-------------	-----------	-----------------	----------------------	--------------------	-----------------

Larsen & Toubro Ltd standing in the name of Purnima Dabhi (Deceased) & Partha Chatterjee (Deceased) have been lost or misplaced or stolen and the registered holder(s) of the said shares should get them to our Registrar, RKT Technologies Limited, Selenium Tower B, Plot 31-32 Gachibowli, Financial District, Hyderabad-500032 within one month from this date else the Company will proceed to issue duplicate Certificate(s).

Place: Mumbai  
 Date: 24.03.2025  
 Purnima Dabhi & Partha Chatterjee  
 Name(s) of Shareholder(s)

**Expression of Interest (EOI) GEI POWER LIMITED (UNDER-CRIP)**  
 The GEI Power Limited NCT ID 028999P199L0000262 is undergoing CRIP for offer of Non-Convertible Debt Instruments, manufacturers of air cooled heat exchangers (ACHE) and cooled steam condensers (CSCS) units located in Sholap, having the following assets:

- Manufacturing facility at 1,00,000 square meters situated at Plot No. A-10, Industrial Area Phase II, Gandhinagar, Gandhinagar, Gandhinagar (M.P.).
- 48 flats in buildings known as Narmada 1, Narmada 2 and Narmada 3, India Realty, Kharsa 7/2, Mandhapur, Tehsil-Gohadri, District-Raisen (M.P.).

Note: The aforementioned properties of the CD are currently involved in ongoing cases before the DRT, Jabalpur. The RP has filed applications for possession of these properties before the DRT, Jabalpur.

U.S. 25(2)(b) of IBC 2016 RP invites prospective resolution applicants to submit a resolution plan. Please write email at power@rupromsolvency.com to seek further details about the Corporate Debt Last date for receipt of expression of interest: 29-04-2025

CA Jagdish Kumar  
 Resolution Professional  
 In the matter of GEI Power Limited  
 Regd. no.: IBBIPA-001/P-0067/12017/11, Ring Road No. 1, Rajpur, Chhattisgarh - 492013

Date: 26-03-2025  
 Place: Rajpur

**UPL**  
 CIN: L2410G1999GP0001352  
 Regd. Office: Survey No. 324, 387, 358, Borisana, Kad - Thol Road, Kad, Mahesana - 382715, Gujarat, Bharat  
 Telephone: +91 260 2432718  
 Email: upl@investingindia.com; Website: www.uplindia.com

**NOTICE TO SHAREHOLDERS OF THE COMPANY**  
 Sub: Transfer of Sale Proceeds of fractional entitlement of preference shares which has not been claimed for seven consecutive years to Investor Education and Protection Fund Authority

This Notice is published pursuant to the provisions of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 (the Rules), as amended from time to time. The Sale Proceeds of fractional entitlement which has not been claimed or claimed for seven consecutive years are mandatorily required to be transferred to the Investor Education and Protection Fund (IEPF), a fund constituted by the Government of India under Section 12A(5) of the Companies Act, 2013.

The Company has sent individual communication to the concerned shareholders holding Optionally Convertible Preference shares at their address registered with the Company whose Sale Proceeds of fractional entitlement is liable to be transferred to IEPF under the said Rules. By this notice information is given that the Sale Proceeds of fractional entitlement which have not been claimed for 7 years i.e. since the year 2017 are proposed to be transferred to IEPF.

The concerned shareholders are hereby requested to claim their Sale Proceed amounts by making an application on or before 31st May, 2025 to the Company or Company's Registrar viz. M/s. MUGF India Private Pvt. Ltd., C-101, 247 Park, L. B. St. Marg, Vikhroli (West), Mumbai - 400083, Mobile no.: +91 810816767, e-mail: ml.helpdesk@linkintime.com (in Registrar).

The following details are to be provided to claim the unclaimed sale of fractional entitlement: 1. Name of the shareholder or RP and Client ID, 2. Name of the shareholder including joint holder, 4. Contact details like email ID and telephone number 5. Address. Please also provide self-attested KYC documents of the shareholder like PAN, cancelled cheque left along with latest utility bill as address proof. Please note that if there is a change in any of your details, additional information, supporting's could be asked by the Registrars.

In case the claim is not received before the date mentioned above, the relevant Sale Proceeds of fractional entitlement will be transferred to IEPF as per the aforesaid Rules. Please note that no claim shall lie against the Company in respect of the sale of fractional entitlement so transferred to IEPF.

Once the Sale Proceeds of fractional entitlement are transferred to IEPF you can claim the same only from IEPF, by making an application in a form no. IEPF-5, as prescribed under the said Rules.

In case you have any query you may contact the Registrar viz. MUGF India Private Pvt. Ltd., as per the contact information provided above.

For UPL Limited  
 Sandeep Deshmukh  
 Company Secretary & Compliance Officer

Place: Mumbai  
 Date: 25/03/2025

**DOMS**  
 CIN: L3991G0001C0004275  
 Regd. Off: A-19, G.L.O. C. Opp. Rajiv Gandhi Park, Mangalpur - 396711, Gujarat, India.  
 Tel. No.: 743688445 | Email: id@domsindia.com | Website: www.domsindia.com

**POSTAL BALLOT NOTICE**  
 NOTICE is hereby given pursuant to the provisions of Section 108 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("the Act"), read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("the Rules"), Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended, (SEBI LODR Regulations) and General Circular No. 14/2020 dated 8, 2020, 17/2020 dated April 13, 2020, and various subsequent circulars issued, read with Circular No. 06/2024 dated 15, 2024, issued by the Ministry of Corporate Affairs, Government of India ("MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/CFO-POD-2/P/2020/24313 dated October 3, 2020 issued by the Institute of Company Secretaries of India, and in accordance with the requirements prescribed by the Ministry of Corporate Affairs ("the MCA") for conducting postal ballot process through e-voting, vide their circulars issued from time to time (collectively, "the MCA Circulars"), the approval of Members of Doms Industries Limited ("the Company") is being sought for the below mentioned business (detailed business have been provided in the Notice of Postal Ballot dated February 10, 2025), by way of voting by electronic means (hereinafter termed as "Remote E-Voting") by following the process of Postal Ballot and remote e-voting.

Sr. No.	Description of Resolutions	Resolution Type
1.	To Approve Appointment of Ms. Shobha Bhatti (DIN: 05318463) as an Independent Director of the Company: Special Resolution	Special

In accordance with the above circulars, the e-Notice of Postal Ballot along with explanatory statement have been sent through electronic mode only, to those Members whose names appeared in the Register of Members ("List of Beneficial Owners maintained by the Company") Depositories as on Friday, March 21, 2025 ("the Cut-off Date") and whose e-mail IDs are registered with the Company's Depositories. Member may note that the Notice of Postal Ballot along with explanatory statement and instruction of e-voting, have been uploaded on the website of the Company at www.domsindia.com, website of BSE Limited at www.bseindia.com, National Stock Exchange Limited website at www.nseindia.com and website of National Securities Depository Limited (NSDL) at www.eoting.nsdl.com.

Further, pursuant to the MCA Circulars, the requirement of sending physical copy of the Notice, Postal Ballot forms and pre-paid business reply envelope has been dispensed with.

The members whose names appeared in the Register of Members and the Register of Beneficial Owners as on the Cut-off date are entitled to vote on the Resolution as set forth in the Notice. A person who is not a member as on the Cut-off date shall treat the Notice for information purpose only. In accordance with the MCA Circulars, the Company has provided the facility to vote on the resolutions by e-voting and for this purpose, the Company has engaged the services of National Securities Depository Limited (hereinafter referred to as "NSDL" or "Service Provider") for facilitating e-voting to enable the Members to cast their votes electronically instead of dispatching postal ballot forms. The detailed procedure and instructions for e-voting are enumerated in the Notice.

In light of the MCA Circulars, the shareholders holding equity shares in Demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the Notice of Postal Ballot along with explanatory statement and instruction of e-voting could not be serviced, may temporarily get their e-mail addresses registered by following the procedure given below:

- In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by E-mail to investor@domsindia.com.
- In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID -CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to investor@domsindia.com.
- Alternatively, shareholders may send a request to eoting@nsdl.co.in for procuring user id and password for e-voting by providing above mentioned documents.

The Company has engaged the services of National Securities Depository Limited (hereinafter referred to as "NSDL" or "Service Provider") for facilitating e-voting to enable the e-voting facility will be available during the following period:

Commencement of e-voting	End of e-voting
From 9:00 a.m. (IST) on Thursday, March 27, 2025	Until 5:00 p.m. (IST) on Friday, April 25, 2025

Once the vote is cast on the resolution, the Member will not be allowed to change it subsequently or cast the vote again.

The Board has appointed **M/s. Piroda Nayan & Co., Practicing Company Secretary (Membership No. 58473, CP No. 23912)** as a Scrutinizer ("Scrutinizer") for conducting the e-voting process in a fair and transparent manner.

The result of the postal ballot will be announced within 2 (two) working days from the conclusion of e-voting i.e. **Thursday, April 29, 2025** and communicated to the stock exchanges and will be displayed on the Company's website i.e. www.domsindia.com.

In case of any query and/or grievance in respect of voting by electronic means, you may contact Mr. Pankaj Mehta, NSDL at eoting@nsdl.co.in or at telephone number 022-4866 7000. You may also refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.eoting.nsdl.com or you can write an email to eoting@nsdl.co.in or Call us: Tel: 022-4866 7000 or Members may also contact Mr. Shyamsunder Panchal, Company Secretary of the Company at the registered office of the Company or may write an e-mail to investor@nsdl.co.in for further clarification.

Date: March 25, 2025  
 Place: Mangalore, Gujarat  
 For Doms Industries Limited  
 Sandeep Deshmukh  
 Company Secretary & Compliance Officer  
 Membership No.: A58993

**TVS MOTOR COMPANY LIMITED**  
 Registered Office: "Chavanya" No. 12 Khadga Nivaz Khan Road Nungambakam Chennai - 600009  
 CIN: L29921TN1992PLC022845 Website: tvsmotor.com  
 Email: contact@tvsmotor.com Ph: 044-28332115

**NOTICE OF LOSS OF SHARE CERTIFICATE(S)**  
 NOTICE is hereby given that the following share certificate(s) issued by the company are lost or have been misplaced or stolen and the registered holder(s) of the said share certificate(s) should lodge such claim(s) with the company at its registered office at the place given above within 15 days of publication of this notice, after which no claim will be entertained into the company will proceed to issue duplicate share certificate(s).

Folio No.	Share Certificate No.	Distinctive No.	Name of registered holder(s)
-----------	-----------------------	-----------------	------------------------------

10269 13473 500 23725990 to 237253486 Indira Narayan Kapoor  
 The public are hereby warned against purchasing or dealing in any way, with the above share certificate(s) or the shares of the company in respect of the said share certificate(s) should lodge such claim(s) with the company at its registered office at the place given above within 15 days of publication of this notice, after which no claim will be entertained into the company will proceed to issue duplicate share certificate(s).

For TVS Motor Company Limited  
 Company Secretary  
 Place: Mumbai  
 Date: 26-03-2025

**BINANI INDUSTRIES LIMITED**  
 CIN: L2417WB1992PLC025554  
 Registered Office: 3172, Chhatrapati Park, New Town Rajpath Main Road, PO Halatla, Kolkata - 700 157, India  
 Corporate Office: Mercantile Chambers, 12 J.N. Heredia Marg, Ballard Estate, Mumbai 400 001

**POSTAL BALLOT NOTICE AND REMOTE E-VOTING INFORMATION**  
 Members are hereby notified that pursuant to Section 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 (including any statutory modification(s) and/or re-enactment(s) thereof for the time being in force) guidelines prescribed by the Ministry of Corporate Affairs ("the MCA") vide General Circular No. 09/2023 dated 25th September 2023 and other relevant circulars issued by the MCA from time to time, Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and any other applicable laws and regulations, the Company has completed dispatch of the Postal Ballot notice on Thursday, March 25, 2025 through electronic mode, only to those members whose e-mail IDs are registered with the Company/Depositories and whose names are recorded in the Register of Members of the Company or Registrar of Beneficial Owners maintained by Depositories as on Friday, March 21, 2025, seeking approval of the shareholders of the Company by Postal Ballot through electronic means, for the following matter:

Type of Resolution	Resolution
Special	To Approve change in name of the Company from Binani Industries Limited to BL Vypaar Limited
Special	To Approve proposed Related Party Transactions

The Company has availed the services of MUGF India Private Limited (Formerly known as Link Intime India Private Limited), for facilitating remote e-voting. The detailed procedure for remote e-voting is listed as a part of the Postal Ballot notice.

**Remote e-voting Schedule:**  
 Cut-off date for eligible or remote e-voting: Friday, March 21, 2024  
 Commencement of remote e-voting period: Wednesday, March 26, 2025  
 Conclusion of remote e-voting period: Thursday, April 24, 2025

Please note that communication of assent or dissent of the members would only take place through the remote e-voting system. The voting rights of the members shall be in proportion to the shares held by them in paid-up equity share capital of the Company as on the cut-off Record date.

A person who is not a member as on the Cut-off date should treat this Notice for information purpose only. Once the vote on a resolution is cast members shall not be allowed to change it subsequently.

The remote e-voting shall be disabled by Link Intime India Private Limited thereafter.

The Board of Directors has appointed H.O. and Associates, Practicing Company Secretaries as the Scrutinizer for conducting e-voting process in the transparent manner.

The Postal Ballot notice is available on the website of the Company https://www.binanindustries.com/ on the website of MUGF India Private Limited (Formerly known as Link Intime India Private Limited) https://nps.mugf.com/ and the website of the Stock Exchange where the Equity Shares of the Company are listed i.e. BSE Limited https://www.bseindia.com/ NSDL Limited https://www.nsdl.com/ and CSE Limited https://www.cse-india.com/.

The Scrutinizer will submit his report to the Chairman of the Company, or any other person authorized by the Chairman, after completion or the scrutiny of the e-voting, and the results will be announced on or before 05.00 PM IST on Friday, April 25, 2025 on the Stock Exchange where the Company's shares are listed. The result will also be available on the website of the Company https://www.binanindustries.com/, on the website of MUGF India Private Limited (Formerly known as Link Intime India Private Limited) https://nps.mugf.com/.

For Binani Industries Limited  
 Sd/-  
 Company Secretary Cum Compliance Officer

Date: March 25, 2025  
 Place: Mumbai

**PGIM India Asset Management Private Limited**  
 4th Floor, C wing, Laxmi Towers, Bandra Kuria Complex, Bandra (East), Mumbai - 400 051.  
 Tel: +91 22 6159 3000 Fax: +91 22 6159 3100  
 CIN: U74900MH2008PT167029 Toll Free No.: 1800 266 7446  
 Website: www.pgimindia.com

**PGIM India Mutual Fund**

**NOTICE**  
 Notice is hereby given that PGIM India Trustees Private Limited, Trustee to PGIM India Mutual Fund, has approved the declaration of Income Distribution cum Capital Withdrawal (IDCW) under the following schemes of PGIM India Mutual Fund with March 28, 2025 as the record date: -

Scheme Names	Plans / Options	Quantum of IDCW per Unit (Gross of Statutory Levy, if any) (₹)	Face Value (₹ per Unit)	NAV of IDCW Option as on March 20, 2025 (₹ per unit)*
--------------	-----------------	--	-------------------------	---

PGIM India Dynamic Bond Fund Regular Plan - Quarterly IDCW Option 18.7521 1000 1088.3283

PGIM India Dynamic Bond Fund Direct Plan - Quarterly IDCW Option 20.7480 1000 1,204.2034

PGIM India Gift Fund Regular Plan - Quarterly IDCW Option 0.2393 10 13.8904

PGIM India Gift Fund Direct Plan - Quarterly IDCW Option 0.2529 10 14.6749

PGIM India Corporate Bond Fund Direct Plan - Annual IDCW Option 1.1390 10 16.7723

PGIM India Corporate Bond Fund Direct Plan - Quarterly IDCW Option 0.2201 10 13.1470

PGIM India Corporate Bond Fund Regular Plan - Quarterly IDCW Option 0.1936 10 11.5646

PGIM India Corporate Bond Fund Regular Plan - Annual IDCW Option 0.7427 10 10.9362

PGIM India Arbitrage Fund Direct Plan - IDCW Option 0.9040 10 12.9329

PGIM India Arbitrage Fund Regular Plan - IDC



